

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૦/૦૩/૨૦૧૬ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૧૯/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૬ કેસ કરી ૫૧ વ્યક્તિઓને ઝડપી ૧૫૬ લીટર દેશી દારૂ, ૩૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ૦૨ બિયરટીન અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૩ કેસ કરી ૦૯ વ્યક્તિઓને ઝડપી રૂપિયા ૬૮,૪૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૨૦/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી.૯૩ મુજબ ૦૮ વ્યક્તિઓની અને પાસા મુજબ ૦૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

લુંટની ફરીયાદ :-

સમાચાર યાદી નં.૫૨૧/૧૬

વટવા : નરેન્દ્રપાલ પુતુલાલપાલ(ઉ.વ.૨૮)(રહે.ગામ: કરજણ, જી.વડોદરા મુળ ગામ : મુતુસુઝાબાદ, મકરનગર તા.જી.કન્નોજ(યુ.પી.) તા.૧૪/૩/૧૬ રાતના ૧૧/૦૦ વાગ્યાના સુમારે પુનીતનગર કોસીંગથી આગળ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમોએ નરેન્દ્રપાલને પેટનાં ભાગે અને પડખામાં છરીથી ઇજા કરી, નરેન્દ્રપાલનાં પેન્ટમાંથી રોકડ રૂપિયા ૧૫,૦૦૦/- તેમજ તેમની પાસેનો થેલો કે જેમાં રોકડ રૂપિયા ૧૦,૦૦૦/- હતા, જે મળી કુલ રૂપિયા ૨૫,૦૦૦/- ની લુંટ કરી પલાયન થઈ ગયા હતા. આ અંગેની ફરીયાદ નરેન્દ્રપાલ નાઓએ વી.એસ.હોસ્પીટલ ખાતે તા.૧૯/૩/૧૬ નારોજ વટવા પોલીસ સમક્ષ નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જે.એચ.સરવૈયા ચલાવે છે.

મોબાઇલ ફોન ખેંચી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૫૨૨/૧૬

ચાંદખેડા : શ્રીમતી રાજશ્રીબહેન જયમનોદપસિંગ અહલુવાલિયા (રહે.શ્યામ બંગ્લોઝ, વિભાગ-૧, આઇ.ઓ.સી.રોડ, ચાંદખેડા) તા.૧૮/૩/૧૬ સાંજના ૫/૪૦ વાગ્યાના સુમારે આઇ.ઓ.સી.ત્રણ રસ્તા પાસે આવેલ એ.એમ.ટી.એસ.બસ સ્ટેન્ડ નજીક પોતાનું એક્ટીવા ઉભુ રાખી મોબાઇલ ફોન ઉપર વાતચીત કરતાં હતા દરમિયાન એવિએટર ટુવ્હીલર ઉપર આવેલ પુરૂષ રાજશ્રીબહેનનાં હાથમાંથી એપલ કંપનીનો આઇ-૬ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૬૨,૦૦૦/- ખેંચી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ રાજશ્રીબહેન અહલુવાલિયાએ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી હિરાજી વેલાજી ચલાવે છે.

“એન” ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન : મોહનસિંહ જ્ઞાનસિંહ ચૌહાણ (રહે.પ્લોટ નં.૧૩૬૧/એ, સેક્ટર ૫/એ, ગાંધીનગર) એ તા.૧૧/૩/૧૬ નારોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૩/૧૬ ના કલાક ૫/૩૦ વાગ્યાના સુમારે પોતાનો પુત્ર જશવંતસિંહ (ઉ.વ.૨૩) પોતાની મોટર સાયકલ ચલાવી, સુંદરવન થી ઇસરો તરફ જતાં ઢાળ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એસ.ટી.બસ નંબર જીજી.૧૮.વાય.૮૧૭૭ ના ચાલકે બસ પુરઝડપે અને બેદરકારીથી ચલાવી, મોટર સાયકલને ટક્કર મારતા જશવંતસિંહને શરીરે ગંભીર ઈજાઓ થતા, સારવાર અર્થે તેમને વા.સા.હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૦/૩/૧૬ નાં કલાક ૨/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું છે. આ ગુનાની તપાસ હે.કો. શ્રી લાલજીભાઈ ખાતુભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.